



# Children's University

(Established by the Government of Gujarat)

Shubhashchandra Bose Sixan Sankul, Sector: 20, Gandhinagar. Phone: 079-23244576, 23244569.

Email Id: [vccu.gujarat@gmail.com](mailto:vccu.gujarat@gmail.com). Official Website Address: [www.cugujarat.ac.in](http://www.cugujarat.ac.in)

## પ્રમાણપત્ર અભ્યાસક્રમ (Certificate Course) પ્રવેશ – ૨૦૧૮-૧૯ માહિતી અને સૂચનાઓ

Certificate Course in Computer Application		
Online ફોર્મ ભરવાની છેલ્લી તારીખ	૨૦/૦૬/૨૦૧૮	રાત્રે ૧૧.૪૫ સુધી
અરજી પત્રક (પ્રિન્ટ) મોકલવાની છેલ્લી તારીખ	૨૩/૦૬/૨૦૧૮	સાંજે ૫.૩૦ કલાક સુધી

### સૂચનાઓ –

- કમ્પ્યુટર એપ્લીકેશનનો સર્ટીફિકેટ કોર્સ પાર્ટ ટાઈમ ધોરણે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, સુભાષચંદ્ર બોઝ શિક્ષણ સંકુલ, સેક્ટર-૨૦, ગાંધીનગર ખાતે ચલાવવામાં આવશે. જેમાં 80 % હાજરી અનિવાર્ય રહેશે.
- યુનિવર્સિટી પ્રવેશ જાહેરાત ક્રમાંક 7 (Certificate Course in Computer Application) માં દર્શાવ્યા પ્રમાણેની લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકશે.
- પ્રવેશ મેળવ્યા પછી પણ કોઈપણ તબક્કે શૈક્ષણિક લાયકાત કે અન્ય માહિતી અધૂરી કે ખોટી રજૂ કરેલી જણાશે તો પ્રવેશ રદ કરવામાં આવશે.
- ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના પ્રવર્તમાન અનામતના ધોરણો અનુસાર પ્રવેશ આપવામાં આવશે.
- ઉમેદવારે પ્રવેશપ્રક્રિયા દરમ્યાન સ્વખર્ચે આવવાનું રહેશે.
- ઉમેદવારે અરજી online કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ આઉટની કોપી, પ્રમાણિત નકલો સાથે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે રૂબરૂ/પોસ્ટ/ કુરિયર દ્વારા તારીખ ૨૩/૦૬/૨૦૧૮ સાંજે ૫.૩૦ કલાક સુધીમાં પહોંચાડવાનું રહેશે (બીજો અને ચોથો શનિવાર, રવિવાર તેમજ જાહેર રજાના દિવસો સિવાય). ત્યારબાદ મળેલ અરજી કોઈપણ સંજોગોમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
- ફી અને ફોર્મ ભરવાની વિગત માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની વેબસાઈટ [www.cugujarat.ac.in](http://www.cugujarat.ac.in) પરની સૂચનાઓનું પાલન કરવું.
- શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૨૦૧૯ માટેની પ્રવેશ પ્રક્રિયા ફી ૨૫૦/- છે જે કોઈપણ સંજોગોમાં પરત મળવાપાત્ર નથી.
- પસંદગી પામેલ ઉમેદવાર જો અંતિમ તારીખ સુધીમાં ફી જમા નહીં કરાવે તો પ્રતિક્ષા યાદીમાં રહેલા ઉમેદવારને અગ્રતાક્રમ અનુસાર પ્રવેશ આપવામાં આવશે. ફી ભરવાની તારીખ પ્રવેશયાદી વેબસાઈટ પર પ્રસિદ્ધ થાય તેની સાથે જણાવવામાં આવશે.
- પ્રવેશ યાદી ધોરણ-૮ ના વાર્ષિક પરિણામના આધારે જાહેર કરવામાં આવશે.
- ઉમેદવારે અરજીપત્ર સાથે ફોર્મમાં જણાવેલ શૈક્ષણિક લાયકાતોના પ્રમાણપત્રો જોડવાનાં રહેશે. ઉપરાંત નીચેનામાંથી લાગુ પડતા પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો જોડવાની રહેશે.
  - એસ.સી./એસ.ટી.ના ઉમેદવારોએ જાતિનું પ્રમાણપત્ર અવશ્ય જોડવું.
  - ઓ.બી.સી.નાં ઉમેદવારોએ તેમનું તાજેતરનું માન્ય નોનક્રિમિલેયર પ્રમાણપત્ર જોડવું.
  - શારીરિક અપંગતા ધરાવતા ઉમેદવારોએ તેમનું વિકલાંગતાનું પ્રમાણપત્ર જોડવું.

